



કોરોનાવાઇરસ (COVID-19) માહિતી અને શાળાઓ – વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે માહિતી

ઓસ્ટ્રેલિયાની – કેન્દ્ર, રાજ્ય અને પ્રદેશ-બધી જ સરકારો ભણતરનું મહત્ત્વ સમજે છે અને COVID-19 મહામારી દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણને ટેકો આપવા કટિબદ્ધ છે.

રાજ્ય અને પ્રદેશ સરકારો અને બિન-સરકારી ક્ષેત્રના અધિકારીઓ તેમની શાળાઓના સંચાલન અને કાર્યકારી નિર્ણયો માટે જવાબદાર છે. તમારા વિસ્તારની શાળાઓ COVID-19નો પ્રતિસાદ કેવી રીતે આપી રહી છે તે વિષયમાં માહિતી માટે પ્રથમ તમારી શાળાનો સંપર્ક કરશો, અને તમારી રાજ્ય અથવા પ્રદેશ સરકારની સલાહને અનુસરશો. રાજ્ય અને પ્રદેશ સરકારોની શૈક્ષણિક વેબસાઇટોની લિંક નીચે છે:

[ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી](#)

[ન્યુ સાઉથ વેલ્સ](#)

[નોર્થ ટેરિટરી](#)

[ક્વીન્સલેન્ડ](#)

[સાઉથ ઓસ્ટ્રેલિયા](#)

[તાસ્માનીયા](#)

[વિક્ટોરીયા](#)

[વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા](#)

શાળાઓમાં COVID-19નો પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગેના નિર્ણયો, નિષ્ણાત, અધિકૃત, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના જાહેર આરોગ્ય અને શૈક્ષણિક સલાહ મુજબ જ લેવાતા રહેશે, તે બાબતમાં રાજ્ય અને પ્રદેશ સરકારોએ સંમતિ દર્શાવી છે.

શાળાઓમાં COVID-19નું સંભવિત જોખમ ઘટાડી રહ્યા છીએ

ઓસ્ટ્રેલિયાની સ્વાસ્થ્ય સુરક્ષા મુખ્ય સમિતિ (એએચપીપીસી)એ ૨૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ શાળાઓમાં COVID-19ના ફેલાવાના સંભવિત જોખમને ઘટાડવાના સંબંધમાં [આરોગ્ય સલાહ](#) જાહેર કરી હતી. COVID-19 મહામારી દરમિયાન શાળાઓમાં કોરોનાવાઇરસ (COVID-19)ના ફેલાવાના સંભવિત જોખમને ઘટાડવા માટે, બાળકો, માતાપિતાઓ, શિક્ષકો અને મદદનીશ કર્મચારીઓ સાથે સંકળાયેલા શાળાના આગેવાનો માટે આ વ્યવહારુ માર્ગદર્શિકા અને સલાહ તૈયાર કરવામાં આવી છે.

ધ્યાનમાં રાખવાની બાબતો સંક્ષિપ્તમાં:

- માતાપિતાઓ માટે: જો તમારું બાળક બિમાર હોય તો, તેઓએ શાળાએ ના જવું જોઈએ. તમારે તેમને ઘરે અને બીજાથી દૂર રાખવા જોઈએ. શાળામાં જતી વખતે તથા બાળકોને મૂકવા કે લેવા જતી વખતે અન્ય માતાપિતા અને શિક્ષકોથી શારીરિક અંતર જાળવી રાખવાનું યાદ રાખો.
- બાળકો માટે: જો તમે બિમાર હો તો, તમારા માતાપિતા, વાલી કે શિક્ષકને જણાવો.
- શિક્ષકો માટે: જો તમે બિમાર હો અથવા નબળા બાંધાના વ્યક્તિઓની શ્રેણીમાં આવતા હો, તો કામ પર ના આવશો.
- બધા જ પુખ્તો માટે: શાળામાં ફેલાવાનું સૌથી મોટું જોખમ પુખ્તો વચ્ચે છે. શિક્ષકો અને વાલીઓ શાળામાં અંદર-અંદર અને એકબીજા વચ્ચે શારીરિક અંતર જાળવે તે ખૂબ જ મહત્વનું છે.

સ્વચ્છતા

વિદ્યાર્થીઓને યાદ કરાવવામાં આવે છે કે:

- વારંવાર તમારા હાથ સાબુ અને પાણીથી ધૂઓ, જેમાં જમતાં પહેલાં અને પછી અને શૌચાલય ગયા પછીનો પણ સમાવેશ થાય છે.
- હેન્ડ સેનીટાઇઝર વાપરો.
- ખાંસી અને છીંક ટીશ્યુ અથવા તમારી કોણીમાં ખાવ (તમારી હથેળીમાં નહિં).
- તમારું વાપરેલું ટીશ્યુ સીધું કચરા પેટીમાં નાંખો અને પછી હાથ ધુઓ.
- તમારા ચહેરા અને મોઢાંને અડકવાનું ટાળો.
- કોઈનો હાથ ના પકડશો કે હાથ ના મિલાવશો.
- તમારી અને અન્ય વચ્ચે સામાન્ય કરતાં વધુ જગ્યા રાખો.
- કતાર બનાવવાનું ટાળો.
- જો તમે ચિંતામાં હો, તો બીજાનો સંપર્ક કરો.

વરિષ્ઠ માધ્યમિક વ્યવસ્થાઓ અને યુનિવર્સિટી પ્રવેશ

૭ એપ્રિલ ૨૦૨૦ના દિવસે રાજ્ય અને પ્રદેશ શિક્ષણમંત્રીઓ સંમત થયા હતા કે, વરિષ્ઠ માધ્યમિક વિદ્યાર્થીઓ (ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ) આ વર્ષે વરિષ્ઠ માધ્યમિક શિક્ષણ (સીનીયર સેકન્ડરી સર્ટિફિકેટ)નું પ્રમાણપત્ર મેળવી શકશે, અને તે પ્રમાણપત્ર થકી યુનિવર્સિટીમાં પ્રવેશ, ઉચ્ચ અભ્યાસ અને રોજગારી શક્ય બનશે.

નેપ્લેન

શિક્ષણમંત્રીઓએ ૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ નિર્ણય લીધો હતો કે, ૨૦૨૦માં નેપ્લેન થશે નહીં. નેપ્લેન ૧૨થી ૨૨ મે ૨૦૨૦ સુધી યોજાવાની હતી.

શાળાના આગેવાનોને, શિક્ષકોને અને મદદનીશ કર્મચારીઓને વિદ્યાર્થીઓની સુખાકારી અને શિક્ષણના સાતત્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ કરવા માટે ૨૦૨૦માં નેપ્લેન ન યોજવાનો નિર્ણય લેવાયો હતો.

નેપ્લેન રાષ્ટ્રીય મૂલ્યાંકન છે કે જે વિદ્યાર્થીઓની સાક્ષરતાના ત્રણ ક્ષેત્રો-વાંચન, લેખન અને ભાષા સિદ્ધાંતો (વ્યાકરણ, જોડણી અને વિરામચિહ્નો) અને અંકશાસ્ત્રમાં ક્ષમતા ચકાસે છે. ૨૦૦૮થી દર વર્ષે મે માં દરેક રાજ્યો અને પ્રદેશોએ નેપ્લેન યોજી છે.